

उद्देश्य मन्त्रः श्री ललाटविंदो मन्त्रः अध्याय ५ Page: 6-1

काय - वाङ् - मनः - कर्मयोगः १-१

सूत्रार्थः काय-वचन-रूपी मनो विद्या यो योगो ह्ये.

टीकावार्थः प.पू. उमास्वामिनः अर्वां आश्रय ललाटे लुम्बिका
"योग" इति शब्दोऽस्ति. योगो अस्ति लीलातिराय तर्जना
हस्तोपशमोऽस्ति अर्थात् हस्तोऽस्ति अस्ति पुद्गलस्य आसंजनो
(माध्यमोऽस्ति) प्रवर्तमानो जातमन्वीयं अर्थात् आत्मशक्तिं.
एतेषु संसारी मनुष्याः शरीरे शक्तिं (उपयोग) मनः, वचनं
रूपेण कायस्य आसंजनोऽस्ति दीयते. आत्मामां शरीरे शक्तिं
अस्ति अस्ति परंतु तेनो उपयोगं तत्रानो स्वीयं तद्वा ह्ये
मनः, वचनं रूपेण कायः. कायस्य आसंजनोऽस्ति ह्ये शक्तिं
उपयोगं नो काययोगं, वचनस्य आसंजनोऽस्ति ह्ये शक्तिं
उपयोगं वचनयोगं, रूपेण मनस्य आसंजनोऽस्ति ह्ये शक्तिं
उपयोगं मनोयोगं. अर्थात् मूलादेः काययोगं, वचनयोगं
रूपेण मनोयोगं यो तद्वा ह्ये पद्मे उत्तर लोके (पद्मादेः)
तन्नेन ह्ये एते लोके ह्ये. (१) काययोग - सात प्रभरे
(२) वचनयोग - सात प्रभरे रूपेण (३) मनोयोग - सात प्रभरे.

काययोगोऽस्ति लोकोः (१) कोटारित (२) कोटारितमिष्ट
(३) कोटारित (४) कोटारितमिष्ट (५) कोटारित (६) कोटारितमिष्ट
रूपेण (७) कोटारित.

(१) कोटारित काययोगः कोटारित-शरीर द्वारा ह्ये शक्तिं
उपयोगं. एता योगं शरीर पर्यायित समाप्त ह्ये जाते
संयुक्तं समसुखं यत्तु रूपेण.

(२) कोटारितमिष्ट मययोगः परममयां उच्चम ह्ये लोको साते
न मय कोटारित शरीरनी रूपेण शब्दोऽस्ति ह्ये. अर्थात्
सुखं नो शरीर सुखे नो शरीर न दीयते अर्थात् सुखं मयानी
प्रवर्तमानो उच्चम कोटारित शरीर ह्ये शक्तिं परंतु
कोटारित मययोगनी पद्मे मये लोके ह्ये. अर्थात् अर्थात् सुखं

જોદારિત શરીર પૂર્ણ હોય ત્યાં સુધી જોદારિત અને મિશ્ર કાર્મણું જ બનેલો મિશ્ર યોગ લાયક છે. જોદારિત શરીર પૂર્ણ થયા પછી ક્રિત જોદારિત મયયોગ લાયક છે.

(૩) વૈદિય કાય યોગ: વૈદિય શરીર દ્વારા જાત્યશાસ્ત્રનો ઉપયોગ. મૂળ વૈદિય કાય યોગ નો વૈદિય શરીર પર્યાપ્ત પૂર્ણ થયા પછી સંપૂર્ણ મય સુધી લાયક છે, અચર ઉચર વૈદિય શરીરમાં ન શરીર લાયક ત્યાં સુધી જ તેનો મયયોગ લાયક છે.

(૪) વૈદિકમિશ્રમયયોગ: મૂળ વૈદિક શરીર (દેવેન્દુ શરીર) ની અપેક્ષાનો કાર્મણું સારત વૈદિક શરીરનો જોદારિત નો વ્યાપાર નો વૈદિક મિશ્રમયયોગ. ઉચર વૈદિક શરીર (જાત્યદારી મુનિ) ની અપેક્ષાનો જોદારિત શરીર સારત વૈદિક શરીરનો જોદારિત નો વૈદિક મિશ્રમયયોગ.

(૫) જાત્યક કાય યોગ: જાત્યક શરીર દ્વારા જાત્યશાસ્ત્રનો ઉપયોગ નો જાત્યક મયયોગ. જાત્યક શરીર નેચર થયા પછી તેનું વિસર્જન હોય નો પૂર્વેના વચરેના સમયમાં જાત્યક મયયોગ લાયક છે.

(૬) જાત્યકમિશ્રમયયોગ: જોદારિત શરીર સારત જાત્યક શરીરનો જોદારિત જાત્યક મિશ્રમયયોગ થયેલ છે. આ મિશ્ર યોગ જાત્યક શરીરનો પ્રથમ તરી વખતે અને વિસર્જન (At the time of removal જાત્યક body) તરી વખતે અંતર્મૂલ્ય સુધી લાયક છે.

(૭) નૈવસ કાર્મણું મયયોગ: જ્યાં પરત્વમાં પુરુષોની જનાં જાત્યક-જોદારિત સમય સુધી આ કાય યોગ લાયક છે. અહીં નૈવસ શરીર સદા કાર્મણુંની સાથેજ રહેતું હોય છે. કાર્મણું શરીરમાં નૈવસ શરીરનો સમાવેશ કરવામાં આવેલ છે.

આ સાત્ત્વમાંથી કોઈપણ સંયતોગ જ્ઞાન્ય થી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુદ્ધર્ત સુદ્ધ જ રહેલો સ્વારણ્ય થોગ બદલાઈ જાયલો. કાચકાગાન બદલે વચનકાગા કે મનાકાગા પ્રવર્તેલો. તેથી એક થોગ સંજાંદી કાશ્રવ પછી જ્ઞાન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુદ્ધર્ત સુદ્ધ જ રાંચ.

વચનકાગા: (૧) સત્યવચન થોગ (૨) અસત્ય વચનકાગા (૩) મિશ્ર (સત્યસત્ય) વચન થોગ અને (૪) અસત્યમૃષા (અસત્યસત્ય) વચન થોગ.

(૧) સત્યવચન થોગ: સત્ય વચન જાહેરવું ની. ઇ.ત.ત. પરમાત્મા સર્વજ્ઞ અને ક્રેવણી છી, જ્ઞાનમાં પાણજી વચાગ તરવો જાચેને, સંવર ઉપાદેય તત્ત્વ છી વગેરે.

(૨) અસત્યવચન થોગ: અસત્ય વચન જાહેરવું ની. ઇ.ત.ત. પાપ નેવું આ વિષયમાં તંજાલેન જરિ.

(૩) મિશ્રવચન થોગ: થોગું સત્ય અને થોગું અસત્ય વચન જાહેરવું ની. ઇ.ત.ત. ઘટા-જાતરા સાદ જઈ રહ્યા રાંચ ની પછી " આ ઘટાકાજાયલો " લાંમ તરવું તેમાં ઘટા જાયલો અસત્ય છી પછી જાતરા જનાં લાવા ઇલાં જ તરવું તે અસત્ય છે મારે તેને મિશ્ર વચનકાગા તથા છે.

(૪) અસત્યમૃષા: સત્ય પછી જરિ અને અસત્ય પછી જરિ તરવું વચન.

મનાકાગા: વચનકાગાના જે ચાર પ્રકાર છી તેજ ચાર પ્રકાર મનાકાગા છી. રહી પછી તજ છે. માત્ર જાહેવાના સ્થાને વિચાર તરવો જાંમ સમજવું. આ રીતે ૭-કાચકાગા, ૪-વચનકાગા અને ૪-મનાકાગા મળીને કુલ ૧૫ થોગ ક્રહા છે.

સાર: આત્મા એક અખંડ દૃવ્ય છે અને મન, વચન,
કાચા એ ત્રણેયો આત્મ પરિણામ રૂપ છે. પ્રથમ
અધ્યાયના પ્રથમ સૂત્રમાં સમ્યક્ દર્શનજ્ઞાનચારિત્રા શિ।
મોક્ષમાર્ગ: કહ્યું તે સમ્યક્દર્શન, સમ્યક્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર
એ ત્રણેયો સમન્વય તે મોક્ષ માર્ગ છે. એ તેમ કરતાં
કાચાદિ ત્રણેયો સમન્વય તે યોગ છે તેમ સમજવું નહીં.
આ સૂત્રમાં રહેલ કર્મ શબ્દ કાચાદિ ત્રણે સાથે જોડવાનો છે.
તેથી કાયકર્મ, વાકુકર્મ અને મનકર્મ એ ત્રણેયો અલગ
અલગ ક્રિયારત્નું જોઈ કાયયોગ, વાક્યયોગ અને મનોયોગ
ત્રણે ભિન્ન ભિન્ન યોગો છે તેમ સમજવું પણ ત્રણેયો
સમન્વય દેવાથી ત્રિય એક યોગ બનેલો તેમ સમજવું નહીં.
આ જે પંદર પ્રકારના યોગ કક્ષા તે શુભ અને અશુભ
જે પ્રકાર છે. વ્યવહારિક જગતમાં જેને યોગ તરવામાં
આપેલો તે યોગ તરત જોઈ દર્શનમાં યોગની વ્યાખ્યા
નહીન અલગ જ છે, આ સૂત્રમાં યોગનો અર્થ
"મન-વચન-કાચાન્ત્રી શુભાશુભ પ્રવૃત્તિ" એવો થાય છે.
સંજ્ઞી પંચોચ્છેદ્ય અવ્યામાં આ ત્રણે યોગ બદલાયા તરેલો
કારણતે તંદિપણા યોગ જઘન્ય છે એક સમયનો અને
વધુમાં વધુ અંતર્મુદૂર્ત ના કક્ષા છે. પરિણામ તરત
અંતર્મુદૂર્તની વધારે એક યોગમાં સ્થિર રવી શકે તે
વાત જ અસભ્ય છે. આથી સામાયિક પણ લોકોની
કહ્યું છે. આ સામાયિકના માધ્યમથી યોગનિરોધ
શુદ્ધિ પરીચલું તે જ આત્માનું લક્ષ્ય લાવું જોઈ.

સ્ત: આશ્રય:

૬-૨

સૂત્રાર્થ: તે (અર્થ) આશ્રય છે.

ભાવાર્થ: મન-વચન-કાર્યના વ્યાપાર રૂપ જે વર્ણ
તે કર્મના બંધ તથાનાર લોકો આશ્રય તથાય છે.
આશ્રય રાજ્યે કર્મોનું શાલ્યું જેમ જારી દ્વારા મકાનમાં
કચરો શાલ્યે જેમ યોગ દ્વારા આત્મામાં કર્મો
શાલ્યે. માટે યોગ પછી આશ્રય તથાય છે.

યોગે કર્મના આશ્રય,
કર્મના આશ્રયે બંધ,
બંધે કર્મના ઉદય,
કર્મના ઉદયે સંસાર

માટે સંસારે છૂટવું હોય તો આશ્રય છોડવા અવશ્ય.
જેમ છોડો દ્વારા નોકીમાં જાણો પ્રવેશ દેતાં તે સમુદ્ધમાં
ડૂબી જાય છે, જેમ યોગરૂપ છોડો દ્વારા જાણે નોકીમાં
કર્મરૂપ જાણો પ્રવેશ દેવાથી તે સંસારરૂપ સાગરમાં
ડૂબી જાય છે.

મન-વચન-કાર્યના યોગરૂપે આશ્રયના બને છે.

(૧) દેહાશ્રય: - મનયોગ, વચનયોગ અને કાર્યયોગ
દ્વારા કર્મોનું શાલ્યું

(૨) ભાવાશ્રય: - જાણના શુભ + અશુભ અધ્યવસાય

આશ્રયમાં મુખ્ય તરફ આત્માના શુભ + અશુભ
અધ્યવસાય છે. કારણકે યોગ હોવા છતાં શુભ + અશુભ
અધ્યવસાય જ હોય તો કર્મના આશ્રય થતાં જ નહીં,
જેમ ૧૩મા ગુણસ્થાને વર્તતા સ્વભાવે ભગવાંતને
શ્રી યોગનું અસ્તિત્વ હોવા છતાં કુર્કે સારાવેદનીય
કર્મના આશ્રય થાય છે.

शुभः पुण्येऽऽ

9-3

सुत्रार्थः शुभयोगो पुण्यमर्थां शाश्वत एव,

भाषार्थः आत्मानो शुभो अर्थावसायकौ धनयोगो शुभयोगः, आत्मानो अशुभो अर्थावसायकौ धनो योगो अशुभयोगः, शुभो शब्दजो एव "प्रशस्त" एव धीयते. अथ प्रशस्त राग, प्रशस्त डोष, प्रशस्त मानो वगैरे, ज्योतिषस्वामीनां अगवान् मरापरस्वामी परतो जे राग एतो ते प्रशस्त रागो तर्थाय.

शुभो धनयोगः :- अहंसा, ईधो गुणो भक्ति, दया, धान, अक्षयवत् वगैरे शुभो धनयोगो एव.

शुभो धनयोगः :- सत्य, अतो अन्तर वाह्य, ईधो-गुणो सुनि, गुणो-गुणोनी प्रशस्तो वगैरे शुभो धनयोगो एव.

शुभो मनोयोगः :- अहंसा, सत्य, अयोध, अक्षयवत्, ईधो-गुणो भक्ति, दया, धान वगैरेना धियावो शुभो मनोयोगो एव.

शुभो कर्मजं धनो तर्थात् अतो शुभो धनो अर्थावसायकौ एव अर्थावसायो पुण्यो एव तर्थाय एव.

पुण्येऽऽ तर्थात् :-

- (1) धानो अतो अर्थावसायो पुण्यो शाश्वत धीय
- (2) धानो वाह्यो अर्थावसायो
- (3) धानो स्थानो अर्थावसायो
- (4) धानो शयन (bed) अर्थावसायो
- (5) धानो वस्त्र (clothes) अर्थावसायो
- (6) मनो शुभो सत्ये उप प्रवृत्ति
- (7) धनो शुभो सत्ये उप प्रवृत्ति
- (8) धानो शुभो प्रवृत्ति
- (9) ईधो-गुणो नमस्कार तर्थात्

शंका :- धानो तर्थात् तर्थाय ?

समाधान :- धीयते एव धीयते मुनि मरावा सुधना सुधानो तर्थाय. धीयते धीयते धानो तर्थाय, अर्थावसायो धानो अर्थावसायो धानो तर्थाय.

અશુભ: પાપરૂપ

૬-૪

સૂત્રાર્થ: અશુભચાંગ પાપનાં સાક્ષ્ય છે,

ભાવાર્થ:

અશુભ કાયચાંગ:- દિસા, ચારી, પરગર, સાક્ષ્યનું સેવન વગેરે અશુભચાંગ છે.

અશુભ વચ્ચચાંગ: તકોર વાહુ, અમલ્ય જાલેયું, ચારિતર જાલેયું, પશુવ્ય-નિંદા તરવ વગેરે અશુભ વચ્ચચાંગ છે.

અશુભ મનોચાંગ: આત્મચાંગ, બહાનના ચારનનું રાંગનું, દિસા, ચારી, વૃદ્ધ, મેલુન- પરગર સંબંધિ વિચારણા, રાગ, ક્રોધ, વર્ષા વગેરે અશુભ વચ્ચચાંગ છે,

૨૮ પાપરૂપના સેવનથી પાપ જંદાય છે.

સંકષ્ટાચા - સંકષ્ટાચાર્યો: સામ્પરાયિત - વર્ણપદ્ધતી: ૬-૫

સૂત્રાર્થ: સંપ્રાય (કષાયવાળા) જીવોનો જે સામ્પર્ય તે સામ્પરાયિત સામ્પર્ય તરવાય છે અને સંપ્રાય જીવોનો જે સામ્પર્ય તે વર્ણપદ્ધિત સામ્પર્ય તરવાય છે,

ભાવાર્થ: સંપ્રાય અટલો સંસાર. એનાથી સંસારમાં પરમ્પર્યથી થાય તે સામ્પરાયિત મર્મ, કષાયના ઉદયવાળા

આત્મા કાયા-વચન ને મજના ચાંગોથી ત્રણ પ્રકારે શુભ અશુભ જોડમાં જાંદ છે અને સામ્પરાયિત સામ્પર્ય ત્રણ છે.

કષાયના સરવાળાથી થતો શુભ ને અશુભ સામ્પર્ય સંસારનો લેવું બનેલો. કારણકે પ્રકૃતિજંદ, પ્રદેશજંદ, સ્થિતિજંદ

અને રસજંદ એ ચાર પ્રકારના જંદમાં સ્થિતિજંદ અને

રસજંદની વિશેષતા છે. કષાયના દીધે શુભ ને અશુભ

સ્થિતિ અને રસના જંદ કાર્દિ થાય છે. જે સંસાર

પરમ્પર્યથી વધારે છે,

અપ્રશસ્ત સાયના સરવાળાથી થતો મર્મજંદ અશુભ

થાય છે અને પ્રશસ્ત સાયના સરવાળાથી થતો

કર્મજંદ શુભ થાય છે.

બંને પ્રકારનો કર્મબંધ સંસારનો લોભુ બનેલો. પણ પ્રશસ્ત કષાયના સંપ્રસારથી થતો શુભ કર્મબંધ પરબ્રાહ્મી સંસારથી મુક્ત થાયનારો છે.

સમ્પ્રાયક દેવ સંપ્રસારિત બંધમાં કર્મો આત્માની સાથે ચીત્તશીલાની ભીંજ ઉપર રજ ચોટે તેમ ચોટી ગય છે અને સ્થિતિ બંધ મુક્તિ લાંબા કાળ સુધી રહેલો. અને અજાદામળ પૂણ્ય દેવો શુભાશુભ ફળ આપેલો.

વર્ષા ચોટે ગમન. પદ ચોટે દ્વારા, ક્રેવળ કષાય રાત્રિ યોગ દ્વારા થતો આશ્રય (અર્થાત બંધ) વર્ષાપદ છે, કષાયરાત્રિ આત્મા આશ્રય (કર્મબંધ) ક્રેવળ યોગથી જ થાય છે, આથી તેને વર્ષાપદ આશ્રય તરોચ છે. આ આશ્રયથી થતો બંધ રસ રાત્રિ લાય છે અને તેની સ્થિતિ પણ સંક્રમણ સમય લાય છે.

જેમ સૂત્રી ભીંજ લાય અને તેના ઉપર લાકડાનો દડો ફેંકવામાં આવે તો તે ચોટી જતો જઈ પણ ભયભંગને પાછો પાછો તેમ કષાયરાત્રિ ફૂટત મન, વચન ને ~~તે~~ તિવાજા જે યોગથી આવતા તમો છે તે આત્માની સાથે લાગીને તરતના ઘૂરા પડી ગય છે.

વર્ષાપદમાં કર્મો પ્રથમ સમયબંધાય, બીજા સમયે ભોલાવાય અને ત્રીજા સમયે આત્માથી વિપુરા પડી ગય છે.

પ્રથમ ગુહ્યસ્થાનત ક્ષે ૧૦ મા ગુહ્યસ્થાનત સુધી કષાયલેય લેવાથી સામ્પ્રસારિત આશ્રય અને ૧૧ થી ૧૩ ગુહ્યસ્થાનત સુધી વર્ષાપદ (અર્થવા વર્ષાપદિત) આશ્રય લાય છે. ૧૪ મા ગુહ્યસ્થાનત યોગનો પણ આત્માવ લેવાથી આશ્રય લેતા જઈ.

શિક્ષા શું બધા જવાને ત્રણેય યોગ લાય?

સમાધાન: જા; અકૌન્દિય જવાને ફૂટત તિયયોગ જ લાય છે.

બેવન્દિય તરવન્દિય, ચક્રિવન્દિય અને અસંજી પંચેન્દિય જવાને કાર્ય અને વચન સોમ જોવાંગી રાય છે.

સંજી પંચેન્દિય જવાને ત્રણેય યોગ (મનો-વાક-તિય) લાય છે.

अज्ञान - कषाय - चिह्नय - द्विधा :

पंच - यजुः - पंच - पंचविंशति संख्याः पूर्वस्य मेधाः

५-५

सूत्रार्थः अज्ञान, कषाय, चिह्नयो रणे द्विधाभावे।
अनुक्रमे पांच, यार, पांच रणे पञ्चविंशति संख्याः
अमं तुल्य उल्लेखो (संपराधित नामना) प्रथम
आश्रयणा र्थे।

भावार्थः सूत्रमां "पूर्वस्य" शब्द र्थे ते सूत्र ५-५ नी
अनुवृत्तिने मारु र्थे, उपरान्त सूत्रमां ले प्रारणा आश्रय
तरे र्थे लेमां प्रथम आश्रय साम्पराधित र्थे मारु
"पूर्वस्य" मारु ले साम्पराधित मारु मारु र्थे।
ले साम्पराधित आश्रयणा उल्लेखो व्यवहारणे।

पांच अज्ञानः (१) रिंसा (२) मूठ (३) यारो (४) मंहुन
रणे (५) परगुल

यार मारु र्थे: द्विधि, मान, माया लीम लरेवा
अनंतानुवृत्ति, अप्रत्याख्यानी, प्रत्याख्यानी, संख्यलन

पांच चिह्नयोः स्पर्शनचिह्नय, रसनचिह्नय, द्वात्रिंशच्चिह्नय,
अक्षुरिचिह्नय रणे प्रीत्रेचिह्नय।

अथ द्विधाभाः

(६) सम्यक्त्वद्विधा :

सम्यक्त्वद्विधा मारु ले मवनी एवे-गुडु-धर्म प्रत्ये श्रद्धा।
लदी नामस्कार, पूजा, मरिण, एतन्, विजय, वंधापस्य
वगरे म् द्विधाभा साम्पराधनीय, एवेगानि, वगरे
पुण्यमन्त्रे आश्रय धार र्थे।

સંદેશનો મહેલ: ક્ષી તત્ત્વાર્થસંગ્રહ સૂત્ર: અભ્યાસ-૬ Page 6-10

(૨) મિથ્યાત્વ ક્રિયા:

મિથ્યાત્વકર ગુણની સામાન્ય દેવ-ગુરુ સંબંધિ
જન્મસ્કાર, પૂજા, ભજન, દાન, ધન્ય, વંદનાદ્ય
વગેરે ક્રિયાકૃતિ મિથ્યાત્વની કૃતિયા હાય છે.

(૩) પ્રયોગ ક્રિયા: આશુભ કર્મબંધ હાય તેવી
મન-વચન-કાયાની ક્રિયા જે કલ્યાણચક્ષુસ રાય

(૪) સમાધાન ક્રિયા:

સમાધાન કરતે સમુદાય

- મુલ્ય (Movie) જોતા TV જોતા આયુષ્યનો
બંધ પડે તો વેરતીતરે વગેરે પ્રત્યક્ષમાં
સાથે ઉપડી જાય. મિત્રોના તરેવોદ્ય રસ વગર
જોડાય એવ તો બની પશુ જાય.
- સાથે (સમૂહમાં) સ્વાધ્યાય તરતા, સાથે પ્રતિષ્ઠા
તરતા, સાથે ધર્મક્રિયા તરતા આયુષ્યનો બંધ પડે
તો દેવગતિ મળે.

(૫) વર્ચાપદ્ય ક્રિયા: ૧૨ હે ૧૩ ગુણસ્થાન સુધે આ
ક્રિયા હાય. ક્રૂતમાં તમાય ધિવાની ગમનાગમનની
ક્રિયા. શાતાવેદનીય કર્મ બંધાય.

(૬) અધિત્રાહિની ક્રિયા: રિંસાના સાદનો જોડા તે
બંધુત, તલવાર, દરી, ભાલા, ચપ્પુ વગેરે બનાવવા
ખરીદવા, વચવા

(૭) કાયાની ક્રિયા: કાયા દ્વારા અવરણા કરતે
ઉપચાર કરત વાજે. રક્ત ઉપર ચાલતા
વર્ચસિમિતનું પાલન ના તરવું.

(૧૫) અનામિતો ક્રિયા : ઉચ્ચારો રરિત - અચ્ચારો રરિત પ્રયુક્તિ, નીચે જોવા દિવત અને તમાજ્ઞ તથા દિવત વસ્તુ મૂલ્ય,

(૧૬) સ્વરસ્ત ક્રિયા : પોતાના લાલો બીજાનો દિવતો તરવો, અરિત તરવું. સંવેદનો સંપલ્લે તમ, કોદેના કાલક્રમાં માલિત પોતાજ તરીલો.

(૧૭) નિસર્ગ ક્રિયા : વાપતરોમાં સંમતિ માપવું કે સ્વીકાર તરવો.

(૧૮) વિદારણ ક્રિયા : વિદારણ = ચીરવું, કોડવું લાઠા કોડવા, તુડા ચીરવા, બીજાના ગુણ વાપતરોની જાહેરાત તરવો.

(૧૯) અનાવચની ક્રિયા : અસ્ત્રાણી કાકા વિરૂદ્ધ પ્રકૃતિ તરવો, પોતે જ પાળી શકે જઈલે પોતાના બચાવ માટે અને પોતાના દોષોને કોંતવા ગમી નેમ જાહેરવું.

(૨૦) અનવતારણ ક્રિયા
વિનયર ભગવાને જલાવલે દારવિનો પ્રમાદકે અનાદર તરવો. દારવે ન સાચવવી ઉપદેશ તરવું

(૨૧) આરંભ ક્રિયા : પ્રકૃતિમાય આદે ભવાને, ભંસે દાય તરવું ક્રિયા.

ભવને મારવાનો ઉદ્દેશ નહીં, મરી જાય લો. મહાન અનાવતા ભવની દિરાદેના દેવ જાય લો. ભવને મારવા માટે મહાન નહીં અનાવતા, રસોર્ષ અનાવતા ભવની દિરાદેના દેવ જાય લો. દિરાદેના તરવા માટે રસોર્ષ નહીં અનાવતા.

(૨૨) ચારિત્રીની ક્રિયા: લોકોને ઘણું ધન મેળવવું તો તેમ ઉપર મૂર્ખા-મમતા તરવી, તેમ રક્ષણ માટે પ્રવૃત્તિ તરવી.

(૨૩) માયા ક્રિયા: ધર્મ ક્રિયા તરતા માયા તરી પોતાના આત્માને અને બીજાનો ઠગી. સંકેશના દેવસી તંઈ તર ન તરું લાયક અને કરતે માટે સંકેશને છે. ઉદાહરણ પાછુ ન વાપરતે લાયક અને કરતે હું વાપરું છું.

(૨૪) મિથ્યાદર્શન ક્રિયા: આ લોકે લોકે પરસ્પરના સુખનો વચ્ચે મિથ્યાદર્શનની સાધના તરવી. મિથ્યાત્વની પ્રવૃત્તિ કાય તીલા તરીકે તરવા

(૨૫) અપ્રવ્યાજન ક્રિયા: જે પાપો જાવનમાં ન જ કરવાના લાયક હતા તેમો મન-વચન-ત્રાસની જો વ્યવસ્થા ન તરીકે લાયક તો તેમો પ્રવચને પાપ તરવાની ભાવના અતી નથી કરતે આશ્રવ ચાલુ છે. પ્રવ્યાજન ન લેવાના તરણે આ ક્રિયા ચાલુ રહે.

સંક્રાંતિ: સાંપ્રતિ આશ્રવના ભેદોમાં વર્ણવ્યા કષાય અને અવગતો જહાણના ભેદો ક્રિયા છે. ત્યાર પછી રથ ક્રિયાને દોરી આશ્રવ તરી. આ રથ ક્રિયાઓમાં આશ્રવ સમજ શકાય છે તો પછી વર્ણવ્ય, કષાય અને અવગતોને મિદેશ તરવાની શું શરૂ ?

સમાધાન: પ્રક્રમ ચોગ્ય છે, કેવળ રથ ક્રિયાના ભેદોને આશ્રવના ભેદોને મિદેશ લેવી શકે છે. પરંતુ આ રથ ક્રિયાઓમાં વર્ણવ્ય, કષાય અને અવગતોને કારણ છે તરું જહાણના માટે વર્ણવ્યાદે તરણે પ્રવૃત્તિ તરત છે.